

CRESTCHEM LIMITED

Reg. office: Sr. No. 550/1, Sub Plot o. 12, Village Indrad, Taluka -Kadi, District- Mehsana, Pin code-382715, Gujarat.
Phone : +91-9409119484, Email : info@crestchemlimited.in GST Number : 24AAACC8722C1Z5
CIN NO. L24100GJ1991PLC015530/WEBSITE : www.crestchemlimited.in

14/08/2021

To,

The Bombay Stock Exchange Ltd.
The Department of Corporate Services,
PhirozJeejeebhoy Tower,
Dalal Street,
Mumbai -400001

BSE Code - 526269

Dear Sir,

Sub. : Announcement under Regulation 30 (LODR) – News Paper Publication

With regard to captioned subject, we enclosed herewith copy of e-newspaper of Extract of Unaudited Standalone Financial Results of the company for the quarter ended June 30, 2021 which has been published on Lokmitra Gujarati (Gujarati News paper) and Freepress Gujarat (English Newspaper) August 14 ,2021

Yours Truly

For, Crestchem Limited


Khyati Vyas
Company Secretary



MSU, HCPL to launch PG course in industrial chemistry

Ahmedabad : MS University in collaboration with Heubach Colour Private Limited (HCPL) is launching a post graduate diploma programme in industrial chemistry and sustainable technologies. An MoU to this effect was signed on Tuesday to start the collaboration in the streams of chemical engineering and material science. As part of MoU, HCPL will be facilitating project internships at HCPL and other industries," said Kataria. "The objective of MoU is to provide chemical industry specific knowledge, exposure and training to fresh post-graduates of any branch of chemistry and graduates from chemical engineering or material science streams," said professor Hari Kataria, dean of faculty of Science. "Students taking up the course will have an opportunity to do a four-month-long industry-specific training. As part of MoU, HCPL will be facilitating project internships at HCPL and other industries," said Kataria. "The objective of MoU is to provide chemical industry specific knowledge,

signed in presence of MSU vice-chancellor professor Parimal Vyas, officiating registrar Dr K M Chudasama and HCPL director Ravi Kapoor. A large number of senior industry professionals, few renowned faculty members from institutes of national repute along with faculty members from chemistry department, applied chemistry department, chemical engineering and pharmacy departments of the university have committed to teach and share their expertise for this course. "Students taking up the course will have an opportunity to do a four-month-long industry-specific training. As part of MoU, HCPL will be facilitating project internships at HCPL and other industries," said Kataria. "The objective of MoU is to provide chemical industry specific knowledge,

It's not enough to have freedom, one must know how to practice that freedom



Vinod Chandrashekhar Dixit
Free-lance Journalist, Writer & Cartoonist
(dixitpatrakar@yahoo.in)

freedom. Thousands of our freedom fighters sacrificed their lives and millions of them struggled in order to drive away British rulers and constituted a system of democracy centered around. How our nation has fared over the last 69 years is something we cannot change but the future is in our hands. India's Independence Day is a day of great significance for the people of India. At this day India got freedom from the British rule after long years of slavery. This is a special day when we remember the great sacrifices of Bhagat Singh, Sukhdev, Raj Guru, Gandhiji and other dazed freedom fighters for their unforgettable contribution in the independence of India.

Don't we forget the importance of this day soon after the evening? Aren't we attaching too much importance to this day, not freedom rather than to the national independence? Why is there little sense of pride in the country about what our parents and grandparents managed to achieve against all odds? The awakening of masses by Gandhi and the activities of Bose behind the scenes (of strengthening Indian National Army) which had intensified during 1940s were already a cause of concern for the British.

It was Lord Mountbatten who had personally decided the date of Aug 15 because he had considered that date to be "very lucky" for his career. During the World War II, it was on Aug 15, 1945 (Japan timezone) that the Japanese Army had surrendered before him (Lord Mountbatten was the commander of the allied forces). In the midnight of 15 August 1947, India was proclaimed as independent country by the Pandit Jawaharlal Nehru where he gave his speech over "Tryst with destiny". He said during his speech that "Long years ago we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes, but rarely in history, when we step out from the old to the new, when an age ends and when the soul of a nation, long suppressed, finds utterance. We end today a period of ill fortune, and India discovers herself again." Today our country is a well established democratic country all over the world. Gandhiji was great leader who taught us about effective way of freedom like ahimsa and satyagraha methods. Gandhiji dreamed of an independent India with the non violence and peace.


It was not so easy for the India to get freedom from the Britishers however; various great people and freedom fighters of India made it a truth. Let us be grateful to those events responsible for the freedom in India. Indians were treated more badly than slaves by the Britishers just to fulfill their meaningless orders. Let us ensure that we exercise our rights and proudly participate in our democracy so that our nation heads in the right direction. The Celebration of Independence day is the same throughout the country and this is the day when we find whole country celebrating and rejoicing but the real celebration is to worship those patriots who shed their blood for achieving Freedom. We are today free, but we have to preserve our hard won freedom. For this, we have to keep alive in our hearts the sacred memory of those great martyrs who made tremendous sacrifices for the attainment of freedom. Let us derive inspiration to work hard to consolidate the freedom we have won at such great cost and hope to reach the highest summit of prosperity to make India a heaven on this earth. (B-15 Jyoti-Kalash Sateelli, Jodhpur Tekra, Satellite, Ahmedabad - 380 015)

This 75th Independence Day MX TakaTak collaborates with Arjun Kanungo



Ahmedabad, Patriotic songs fit into the definition of having an eternal and innate power to stir every civilian's deepest emotions. On the momentous celebration of our 75th Independence Day, India's leading short format video app, MX TakaTak joined hands with popular singer-actor Arjun Kanungo to bring audiences a new inspirational track - "Jaya Hey". MX TakaTak has undoubtedly been the preferred destination for India's leading content creators and has seen massive growth in the user-generated content category. Supporting the creator community on their platform, MX TakaTak has given a once-in-a-lifetime chance for its music content creators - Gurni Bhat and Rabbit Sack C to collaborate with an established artist like Arjun Kanungo, along with Pooja Goyal who is an aspiring rapper and voice actor. Creators like Vishal Kalra, Arpit Dadhich, Mahira Khan, Kajal Chandravanshi, Noor Afshan, Prem Vats and Vihaan Goyal who have won audiences with their individual talent have also got an opportunity to feature as part of the engaging music video. (19-10)

Witness the ruthless Power Game that rules the maximum city of Mumbai



Ahmedabad, Mumbai - some call it the city of dreams, others refer to it as the maximum city since it's the hub of all activity and in the case of the upcoming crime drama, Cartel, it is the backdrop against which 5 gangs go up in arms to become the most powerful ruler of this city. The Angra family has been making waves in the news recently and helmed by veteran actor Supriya Pathak as Rani Maai, this business family is suddenly facing a crisis when she is shot. With cracks forming within the family and scrambling to rule as the cartel head in her stead, her 3 sons- Abhay, Major Bhau and Madhu Bhau (essayed by RitvikDhanjani, Tanuj Virwani and Jitendra Joshi respectively) are out to seek vengeance for the attack and the other 4 gang leaders also decide to make a play for power and own the city of Mumbai. No loyalty, no blood ties, and a relentless battle for power - Cartel takes viewers through the mystery of who shot Rani Maai, it could be any of the other power-hungry crime lords who are trying to break the Angra family and fingers are even pointed within the Angra family itself as an unquenchable thirst to rule this city that shatters all familial relationships, breaks the existing gang treaty and suddenly, no one is loyal to anyone and it's a matter of survival of the fittest. All episodes of this series will stream on MX Player's subscription VoD service - MX GOLD, plans starting at less than Rs1/day (available on Android) as well as onALTBalaji. (19-8)

Iqbal Khan: "Tumhari Paakhion Azaadcuts across all class, culture and language!"



Ahmedabad, The actor known for his effortless natural performances on TV, films and web series, Iqbal Khan, has always stood apart in the fraternity for his choices and conviction. One of his top rated shows, TumhariPaakhi currently airs on Azaad, India's 'FIRST Premium Hindi Entertainment Channel' that will feature Content Exclusively for the "Rural Mindset". With a powerful storyline adapted from "Sarat Chandra Chattopadhyay's novel Nababidhanand produced by Shashi Sumeet Productions, the charismatic actor Iqbal enacted the author backed role of AnshumanRathore in TumhariPaakhi. Also starring in the show is the beautiful and talented Shiradha Arya and the show airs on Azaad, every Monday to Sunday, at 8 PM. With his mantra for success being staying happy and content with all he does, Iqbal shares his journey that relives his experience shooting on TumhariPaakhi after the fabulous response the show has received from rural audiences on Azaad. (19-8)

Manipal Academy unveils plans for back to campus



Ahmedabad, Manipal Academy of Higher Education (MAHE), an institution of eminence and one of India's leading academic and research institutions unveiled their plans on back to college campus and the preparations that are underway for a smooth transition from online to classroom mode for all its students. The press conference was addressed by Dr. HS Ballal - Pro-Chancellor, Manipal Academy of Higher Education, Lt Gen (Dr) M D Venkatesh, Vice Chancellor, Manipal Academy of Higher Education Dr Naranjan Sabhahit - Registrar, Manipal Academy of Higher Education, and Mr. SP. Kar, Convener of Press Conference and Director, PR Media & Social Media Cell- Manipal Academy of Higher Education. Further to the announcement made by the Government of Karnataka for students of Higher Education and professional colleges to return to campus, MAHE too has paved the way for all its students to make this transition seamless and how all the colleges and universities of MAHE will function as per the protocols and ensure the students are safe and continue their learning in the shadow of the pandemic. In addition, since the announcement of NEP 2020, MAHE is aligning all its courses across its colleges in line with the proposed guidelines by the Government of India last year. (20-4)

Organ Transplant Specialist from Fortis Hospital organize organ donation awareness drive



Ahmedabad, To highlight the significance of organ donation, and to acknowledge the efforts of courageous donors & recipients of Liver Transplant surgeries, Liver specialists led by Dr Gaurav Gupta, hosted a felicitation ceremony and an awareness drive at Ahmedabad today. Liver recipients Vijay Soni, Bharat Babriya, Suresh Devani, Keshubhai Sakariya and Umakant Mishra came in with their families to support this initiative. The initiative led by Dr Gaurav Gupta, Consultant & Chief Surgeon, Dept. of Liver Transplant and HPB Surgery, Fortis Hospital, Mulund Mumbai said, "In India, the cause of organ donation has gradually and progressively gained momentum, but the COVID-19 pandemic dealt a heavy blow to this effort. (19-10)

67 villages fully jabbed in Chhota Udepur

Ahmedabad : Tribal-dominated Chhota Udepur district achieved a feat of administering first dose of COVID-19 vaccine to the entire population of 67 villages in the district by Monday. Sankheda taluka of the district had the highest vaccination as 25 villages were vaccinated followed by 15 and 13 villages of Bodoli and Naswad taluka respectively. Nine villages of Pavi Jetpur taluka, three villages of Kawant and two villages of Chhota Udepur taluka were also vaccinated. Officials said that people had misconceptions about the vaccination so different awareness programs were done. "Our health staff used to visit remote villages and explain people why vaccination is important so now people are voluntarily coming forward to take the vaccine," said an official.

SAP India and Microsoft launch tech skilling program

Ahmedabad, With a shared commitment to enable digital equity, SAP India and Microsoft announced the launch of a joint skilling program TechSaksham, for empowering young women students from underserved communities to build careers in technology. Through this joint initiative, SAP India and Microsoft are training 62,000 women students in digital intelligence, cloud computing, web design, and digital marketing. The program will partner with the AICTE Training and Learning Academy-ATAL and State Collegiate Education departments, to support the professional development of faculty at participating institutes. In the first year of implementation, the initiative will train 1,500 teachers and each faculty trained will have equipped to support over 50 students in one year, impacting 60,000 - 75,000 students. A collaborative, pan India initiative, this program will be implemented by Edunet Foundation, who will develop future-ready skills in young women graduating in computer, engineering, computer applications, and vocational studies. The program offers a core curriculum to understand the application of technology and activity-based engagements to implement the skills under expert mentors, ensuring job readiness. Students will also get an opportunity to showcase their work to business leaders and experts from local industries, helping establish early linkages with industry practitioners. (20-4)

ADINATH EXIM RESOURCES LIMITED

12A 3rd Floor, Abhishek Corporate Park, Ambli Bopal Road, Ambli, Ahmedabad- 380058, Gujarat
Ph: 02717-298510; Fax: 02717-298520; E-mail: aernadlofficer@gmail.com
Website: www.adinatheximresources.com; CIN: L65100GJ1995PC024300

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2021 (Rs. In Lacs except EPS)					
Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		30.06.2021 (Unaudited)	30.06.2020 (Unaudited)		31.03.2021 (Audited)
1	Total Income from Operations (Net)	2383	1639	2435	8667
2	Profit / (Loss) for the period (Before Tax, Government and for Extraordinary Items)	2085	2223	491	6586
3	Profit / (Loss) for the period after Exceptional (Before Tax and Extraordinary Items)	2085	2223	491	6586
4	Profit / (Loss) for the period after Exceptional and for Extraordinary Items (Before Tax)	2085	2223	491	6586
5	Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)	1435	1669	189	4774
6	Equity Share Capital	421.91	431.91	423.03	421.91
7	Other Equity	0.00	0.00	0.00	104586
8	Earning Per Share (Face Value of Rs.10/- each)	0.33	0.39	0.04	1.11

The above results were recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on August 13, 2021.

For, ADINATH EXIM RESOURCES LIMITED
54/-
Manoj S. Salva
Managing Director
DIN: 01529306

Date: 13.08.2021
Place: Ahmedabad

CRESTCHEM LIMITED

CIN: L24100GJ1991PL015530
Regn Office Address: Sr. No.550/1, Sub Plot No. 12, Village: Indrad, Taluka: Kadi, Mahesana- 382713

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30TH JUNE, 2021 (Rs in Lacs)					
Sr. No.	Particulars	Quarter ended		Year ended	(Rs in Lacs)
		30.06.2021 (Un-audited)	31.03.2021 (Un-audited)		
1	Income				
	Income from operations	148.70	253.65	150.06	764.17
	Other Operating income	-	-	-	62.45
	Total Income from Operations (net)	148.70	253.65	150.06	764.17
	Other Expenses	1.58	5.99	1.14	4.43
	Total Income (a-b)	150.29	255.24	151.91	765.99
2	Expenses				
	Cost of Material Consumed	113.22	185.06	116.14	581.52
	Purchase of Stock in Trade	-	-	-	488.77
	Changes in Inventories of Finished Goods, Work in progress and stock in trade	0.03	0.16	-	0.32
	Depreciation	0.03	0.03	0.03	0.03
	Employee benefits expense	7.02	30.43	3.26	46.54
	Finance Costs	0.68	0.73	0.15	1.61
	Disposition & amortization expenses	0.85	0.67	0.37	2.38
	Other Expenses	14.28	8.07	22.76	69.88
	Total Expenses (a-b+c+d+e+f+g)	135.78	225.12	142.69	702.26
3	Profit before Tax (1-2)	14.51	30.12	8.52	67.33
4	Tax expense	-	-	-	-
	Current Tax	2.26	0.28	2.26	10.51
	Deferred Tax	(0.67)	(1.80)	2.27	(0.50)
	Total Tax (h)	1.59	2.58	4.53	9.32
	Profit for the period (3-4)	12.92	27.54	3.99	57.42
5	Less: Non Controlling Interest	-	-	-	-
6	Net Profit after Non Controlling Interest (5-4)	(2.86)	(2.86)	(2.86)	(2.86)
7	Other Comprehensive Income				
	Total comprehensive income for the period (5+6)	13.22	27.54	3.99	57.42
8	(Comprising Profit/Loss) and other Comprehensive Income for the period)				
	Profit up to Equity share Capital: Face Value of 10 each	300.00	300.00	300.00	300.00
9	Earning per equity share (EPS) in (not Annualized)				
	BASIC	0.41	0.92	0.13	1.91
	DILUTED	0.41	0.92	0.13	1.91

Notes: (I) The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under section 133 of Companies Act, 2013 read with Rule 3, of the Companies (Indian Accounting Standards) Rule, 2015 and Relevant Amendments thereunder. (II) The above Unaudited Financial Results for the Quarter ended June 30, 2021 have been reviewed by the Audit Committee and were taken on record by the Board of Directors in their respective meetings held on 12th August, 2021 and a Limited Review of the same has been carried out by the Statutory Auditors of the Company. (III) The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above results as per Regulations 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. (IV) The Company operates in one segment viz. Nutrition- Chemical Industries. (V) Due to outbreak of COVID-19 globally and in India, the company's management has made initial assessment of likely adverse impact on business and financial risks, and believes that the impact is likely to be short term in nature. The management does not see any medium to long term risks in the company's ability to continue as a going concern and meeting its liabilities as and when they fall due. The Management based on current estimates expects that the carrying amounts of Receivables, Inventories & Advances will be recovered, net of provisions made. The extent to which the COVID-19 pandemic will impact the company's financial performance is dependent on future developments, which are highly uncertain including among other things, any new information concerning the severity of the COVID-19 pandemic and any action to contain its spread or mitigate its impact whether government mandated or elected by the Company. Given the uncertainty over the potential macro-economic conditions the impact of COVID-19 pandemic may be different from that estimated as at the date of approval of these financial statements and the company will continue to closely monitor any material changes to future economic conditions, which will be given effect to in the respective future period. (VI) Figures for the previous period have been regrouped, reclassified and restated wherever necessary to make them comparable with the current period's figures.

By order of Board of Directors
For Crestchem Limited
Dipak Patel
Director
(DIN : 02052080)
Place: Indrad, Kadi
Date: 12th August, 2021